https://archive.org/details/bk1205/page/n0/mode/1up

1955-09-01 -Mein Pirana Satpanth Sha Mate Tyag Karyo (1205)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

પત્રિકા નં. ૧) પહેલી

મેં પીરાણા સતપંથ શા માટે ત્યાગ કર્યો ?

પીરાણા પંથીઓને વિજ્ઞપ્તિ.

આજે લગભગ સાત આઠ વરસ થયા અમો દેશમાં (કચ્છ) આવ્યા છીએ. તે પછી હું જાહેર મેળાવડામાં "પીરાણા સતપંથધર્મ" સંબંધી કાંઈ બોલ્યો નથી. પણ પીરાણા ધર્મનાં શાસ્ત્રોનો મારો અભ્યાસ જોવોને તેવોજ ચાલુ છે. તે જોઈ હમણાં મારા પરમ સ્નેહી એક ભાઈએ કહ્યું કે "ભાઈ હું જ્યારે જોઉં છું ત્યારે તમારા હાથમાં પીરાણા ધર્મનુંજ પુસ્તક હોય છે. આટલો બધો તમને "પીરાણા ધર્મ" પ્રત્યે પ્રેમ છે છતાં પણ તમોએ "પીરાણા સતપંથધર્મ"નો શા માટે ત્યાગ કર્યો ?" આ સાંભળી મને ઘણો આનંદ થયો. તેમેને તેમના સવાલનો જવાબ આપીશ. પણ હાલ તુરતમાં તેમને જાણવા પુરતું તો મારે કાંઈક લખવું જોઈએ એમ મારા અંતરાત્મામાં મને થયું. જેથી થોડુકજ આ નીચે જણાવ્યું છે અને પુરતો જવાબ લખવો પણ ચાલુ છે.

વ્હાલા ભાઈ, તમો જે "પીરાણા ધર્મ પાળી રહ્યા છો તે શું છે ? તે ધર્મ છે કે ધતિંગ ? જો કહો કે ધર્મ છે, તો તે હિન્દુ ધર્મ છે કે મુસલમાની ? અગર તો તમે મુસલમાન બનવાની ઈચ્છા રાખો છો કે હિન્દુ રહેવાની ? તેની તમને જાણ થવા માટે આ લખવુ પડ્યું છે. "પીરાણા સતપંથધર્મ"ના સિદ્ધાંતો તથા રિવાજો ટુંકામાં સત્ય હકિકત બહાર લાવવા ખાતર આ મેં બતાવી છે કે જેથી તમે સીધે રસ્તે જાઓ છો કે ઉલ્ટે તેની તમને ખબર પડે-જાણ થાય અને તમે હિન્દુ છો કે મુસલમાન તેનું પણ ભાન થાય. એટલાજ માટે જે કંઈ હકિકત મારા અનુભવમાં આવી છે તેમાંથી થોડીક જણાવું છું.

આ પંથ ચાલુ કરનાર "પીર સમ્સ" છે જેને તમે 'સમ્સદીન" ના નામે બોલાવો છો તે પીર સમ્સદીન પછી પીર "નસીરદીન" ત્યાર પછી પીર "સાહેબદીન" પછી પીર "સદરૂદીન" તેમના પછી તેના દિકરા પીર "કબીરદીન" ને છેવટે તેમના દિકરા તમારા સતગોર "ઈમામશાહ" કે જેઓ ઈરાનમાં જઈ કાસ્પીઅન સમુદ્રના કિનારે આલમોતના કિલ્લામાંનું સ્વર્ગ કે જે સતપંથીઓના સ્વર્ગ તરીકે ઓળખાતું હતું (જે બનાવટી સ્વર્ગનું બ્યાન તમારા ગોર ઈમામશાહે જન્નતનામાં નામના શાસ્ત્રમાં કર્યું છે) તે જન્નત તથા તેની ધર્મ પ્રચાર કરવાની પદ્ધતિ જોઈ આવ્યા પછી વિચાર કરી તેની યુક્તિ અને પદ્ધતિ મુજબ ગુજરાતમાં આવી "અટુણા" નામે ગામમાં પહે... સતપંથની જાળ બીછાવવાની શરૂઆત કરી અને ત્યાંથી આગળ વધી અમદાવાદ પાસે "ગીરમથા" ગામમાં મૂકામ રાખી ત્યાંના ભોળા લોકોને પોતાની જાળમાં સપડાવવા માંડ્યા. તેમાં "નવસારી"ના લેવા કણબીઓના યાત્રાળુ સંઘને જાળમાં લીધા પછી તો તેનું તૂત આગળ ચાલવા માંડયું. તેમાં હજારો ભોળા હિન્દુ પંખીડાના ગળામાં સતપંથના ગુરૂ ગંટાળે ધન હરણ કરવાની જાળ નાખી.

તેમ કરવામાં અમદાવાદના બાદશાહ મહમદ બેગડાએ આ સૈયદને ખૂબ મદદ કરી એક વાડી (ખેતર) આપી તેમાં મકાનો બંધાવી આપ્યાં. હિન્દુ લોકોને તેમનો હિન્દુ ધર્મ છોડાવી પોતાના દિનમાં (મુસલમાની ધર્મમાં) લેવા રચેલી જાળમાં ઘણા અજ્ઞાન ભોળા હિન્દુઓ ફસાવા લાગ્યા તેમ તમારા પૂર્વજો પણ ફસાયાં અને ઇમામશાહના કહેવા મૂજબ મુસલમાની ધર્મની રિતભાત પાળવા લાગ્યા. જેથી ત્યાંના તેના જ્ઞાતિભાઈઓ કે જે વૈદિક સનાતન ધર્મ પાળતા હતા તેમણે તેઓને નાત બહાર મૂકયા. આ નાત બહાર થનારાઓના ઘર થોડાં હોવાથી બહુ શરમાવા લાગ્યા તેથી ઇમામશાહ પાસે ગયા અને પોતાની વિતક વાત કહી. ત્યારે ઇમામશાહ તથા બાદશાહે ગોઠવણ કરી કચ્છમાં મોકલવાનો વિચાર કર્યો. કચ્છ રાજ્યને તો જોઈતું હતું અને વૈદે બતાવ્યા જેવું થયું. એકતો ગુજરાતના કાબેલ ખેડુતો વિના મહેનતે મળે છે અને દેશની વસ્તીમાં પણ વધારો થાય છે તેમજ બાદશાહનું પણ માન જળવાય છે એમ માની તેઓને આશ્રય આપ્યો અને જે જમીન પસંદ આવે તેમાં ગામ વસાવવાની સગવડતા કરી આપી જેથી કચ્છમાં આવી ગામો વસાવી રહેવા લાગ્યા. અહીંયા મૂળથીજ "પીરાણાપંથી" તરીકે જા... થવાથી ટીકા પણ થઈ નહી તેથી દિનપરદિન ... પંથનો વધારો થવા લાગ્યો. પીરાણાના સૈયદો તથા કાકાએ આવજાવ કરવા લાગ્યા. તેનું પરિણામ એ આવ્યું કે પોતાની વિશાળ પાટીદાર જ્ઞાતિથી અલગ થઈ ગુજરાત જેવી રમણીય ભૂમિનો ત્યાગ કરી કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં નિવાસ કરવો પડયો. છતાં પણ હિન્દુ તરીકેના મૂખ્ય ચીન્હો "ચોરી અનેયે કાયમ રહ્યાં હતાં પરંતુ રોકાઓ પછી એટલે સંવત ૧૮૩૨ ની સાલમાં વિવાહ વખતે પીરાણાંના મુજાવર કાબેલ કાકો પ્રાગજી તથા સૈયદ વલીમીયાં આવ્યા. તેમણે લગ્ન કરાવનાર ગોર દયાશંકર ભગવાનજી સાથે તકરાર કરાવી બધા ગામના ભેગા કરી ઉપદેશ આપ્યો કે બાવા ઈમામશાહના ધર્મના અનુયાયીઓના લગ્ન બ્રાહ્મણ કરી શકશે નહિ પણ દરેક ગામનો મૂખી હોય તે દુવા પડી લગ્ન કરાવી લે અને મરણ પછી અગ્નિસંસ્કાર ન કરવો પણ દફન કરવું. તે દિવસથી લગ્નની તથા મરણ પછીના સંસ્કાર હતા તે પણ બંધ થયા અને ગોર બ્રાહ્મણ તથા ભાટને તમારી જ્ઞાતિમાંથી રજા આપી પુરણ મૂમનની પદવી આપી અને પોતે સૈયદો તથા કાકાપુન્ય બન્યા.

પછી તો વડીલોના ભોળા સ્વભાવને લઈને ગામેગામ ખાનાની જગ્યા બંધાવી તેમાં બેસી ઉપદેશના રૂપે ખોટી લાલચો બતાવી હિન્દુ ધર્મના કટ્ટા શત્રુ કલરપરસ્તી સૈયદો ગુરૂ બન્યા અને ધર્મ ધૂતારા કાકાઓને એજન્ટ બનાવ્યા. હુરાઓના આશક તથા સ્વર્ગના શોખીન એવા મૂખીઓ અને ભગતડાઓને તેઓએ મોટા ભા બનાવીને સૈયદોની વંશાવળીના કલ્પીત

realpatidar.com

https://archive.org/details/bk1205/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v11.py

https://archive.org/details/bk1205/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.21 11:34:24 +05'30'

realpatidar.com

પત્રિકા નં. ૧) પહેલી

મેં પીરાણા સતપંથ શા માટે ત્યાગ કર્યો ?

પીરાણા પંથીઓને વિજ્ઞપ્તિ.

આજે લગભગ સાત આઠ વરસ થયા અમો દેશમાં (કચ્છ) આવ્યા છીએ. તે પછી હું જાહેર મેળાવડામાં "પીરાણા સતપંથધર્મ" સંબંધી કાંઈ બોલ્યો નથી. પણ પીરાણા ધર્મના શાસ્ત્રોનો મારો અભ્યાસ જેવોને તેવોજ ચાલુ છે. તે જોઈ હમણાં મારા પરમ સ્નેહી એક ભાઈએ કહ્યું કે "ભાઈ હું જ્યારે જોઉં છું ત્યારે તમારા હાથમાં પીરાણા ધર્મનુંજ પુસ્તક હોય છે. આટલો બધો તમને "પીરાણા ધર્મ" પ્રત્યે પ્રેમ છે છતાં પણ તમોએ "પીરાણા સતપંથધર્મ"નો શા માટે ત્યાગ કર્યો ?" આ સાંભળી મને ઘણો આનંદ થયો. તેમને તેમના સવાલનો જવાબ આપીશ. પણ હાલ તુરતમાં તેમને જાણવા પુરતું તો મારે કાંઇક લખવું જોઇએ એમ મારા અંતરાત્મામાં મને થયું. જેથી થોડુકજ આ નીચે જણાવ્યું છે અને પુરતો જવાબ લખવો પણ ચાલુ છે.

વ્હાલા ભાઇ, તમો જે "પીરાણા ધર્મ પાળી રહ્યા છો તે શું છે ? તે ધર્મ છે કે ધતિંગ ?" જો કહો કે ધર્મ છે, તો તે હિન્દુ ધર્મ છે કે મુસલમાની ? અગર તો તમે મુસલમાન બનવાની ઇચ્છા રાખો છો કે હિન્દુ રહેવાની ? તેની તમને જાણ થવા માટે આ લખવુ પડ્યું છે. "પીરાણા સતપંથધર્મ"ના સિદ્ધાંતો તથા રિવાજો ટુંકામાં સત્ય હકિકત બહાર લાવવા ખાતર આ મેં બતાવી છે કે જેથી તમે સીધે રસ્તે જાઓ છો કે ઉલ્ટે તેની તમને ખબર પડે–જાણ થાય અને તમે હિન્દુ છો કે મુસલમાન તેનું પણ ભાન થાય. એટલાજ માટે જે કંઈ હકિકત મારા અનુભવમાં આવી છે તેમાંથી થોડીક જણાવું છું.

આ પંથ ચાલુ કરનાર "પીર સમ્સ" છે જેને તમે 'સમ્સદીન" ના નામે બોલાવો છો તે પીર સમ્સદીન પછી પીર "નસીરદીન" ત્યાર પછી પીર "સાહેબદીન" પછી પીર "સદરૂદીન" તેમના પછી તેના દિકરા પીર "કબીરદીન" ને છેવટે તેમના દિકરા તમારા સતગોર "ઈમામશાહ" કે જેઓ ઇરાનમાં જઈ કાસ્પીઅન સમુદ્રના કિનારે આલમોતના કિલ્લામાંનું સ્વર્ગ કે જે સતપંથીઓના સ્વર્ગ તરીકે ઓળખાતું હતું (જે બનાવટી સ્વર્ગનું બ્યાન તમારા ગોર ઇમામશાહે જન્નતનામાં નામના શાસ્રમાં કર્યું છે) તે જન્નત તથા તેની ધર્મ પ્રચાર કરવાની પદ્ધતિ જોઈ આવ્યા પછી વિચાર કરી તેની યુક્તિ અને પદ્ધતિ મુજબ ગુજરાતમાં આવી "અટુણા" નામે ગામમાં પહે... સતપંથની જાળ બીછાવવાની શરૂઆત કરી અને ત્યાંથી આગળ વધી અમદાવાદ પાસે "ગીરમથા" ગામમાં મૂકામ રાખી ત્યાંના ભોળા લોકોને પોતાની જાળમાં સપડાવવા માંડ્યા. તેમાં "નવસારી"ના લેવા કણબીઓના યાત્રાળુ સંઘને જાળમાં લીધા પછી તો તેનું તુત આગળ ચાલવા માંડયું. તેમાં હજારો ભોળા હિન્દુ પંખીડાના ગળામાં સતપંથના ગુરૂ ગંટાળે ધન હરણ કરવાની જાળ નાખી.

તેમ કરવામાં અમદાવાદના બાદશાહ મહમદ બેગડાએ આ સૈયદને ખૂબ મદદ કરી એક વાડી (ખેતર) આપી તેમાં મકાનો બંધાવી આપ્યાં. હિન્દુ લોકોને તેમનો હિન્દુ ધર્મ છોડાવી પોતાના દિનમાં (મુસલમાની ધર્મમાં) લેવા રચેલી જાળમાં ઘણા અજ્ઞાન ભોળા હિન્દુઓ ફસાવા લાગ્યા તેમ તમારા પૂર્વજો પણ ફસાયાં અને ઇમામશાહના કહેવા મૂજબ મુસલમાની ધર્મની રિતભાત પાળવા લાગ્યા. જેથી ત્યાંના તેના જ્ઞાતિભાઇઓ કે જે વૈદિક સનાતન ધર્મ પાળતા હતા તેમણે તેઓને નાત બહાર મૂકયા. આ નાત બહાર થનારાઓના ઘર થોડાં હોવાથી બહુ શરમાવા લાગ્યા તેથી ઇમામશાહ પાસે ગયા અને પોતાની વિતક વાત કહી. ત્યારે ઇમામશાહ તથા બાદશાહે ગોઠવણ કરી કચ્છમાં મોકલવાનો વિચાર કર્યો. કચ્છ રાજ્યને તો જોઈતું હતું અને વૈદે બતાવ્યા જેવું થયું. એકતો ગુજરાતના કાબેલ ખેડુતો વિના મહેનતે મળે છે અને દેશની વસ્તીમાં પણ વધારો થાય છે તેમજ બાદશાહનું પણ માન જળવાય છે એમ માની તેઓને આશ્રય આપ્યો અને જે જમીન પસંદ આવે તેમાં ગામ વસાવવાની સગવડતા કરી આપી જેથી કચ્છમાં આવી ગામો વસાવી રહેવા લાગ્યા. અહીંયા મૂળથીજ "પીરાણાપંથી" તરીકે જાહેર થવાથી ટીકા પણ થઈ નહી તેથી દિનપરદિન ...મા પંથનો વધારો થવા લાગ્યો. પીરાણાના સૈયદો તથા કાકાએ આવજાવ કરવા લાગ્યા. તેનું પરિણામ એ આવ્યું કે પોતાની વિશાળ પાટીદાર જ્ઞાતિથી અલગ થઈ ગુજરાત જેવી રમણીય ભૂમિનો ત્યાગ કરી કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં નિવાસ કરવો પડ્યો. છતાં પણ હિન્દુ તરીકેના મૂખ્ય ચીન્હો "ચોરી અંનયે કાયમ રહ્યાં હતાં પરંતુ સૈકાઓ પછી એટલે સંવત ૧૮૩૨ ની સાલમાં વિવાહ વખતે પીરાણાંના મુજાવર કાબેલ કાકો પ્રાગજી તથા સૈયદ વલીમીયાં આવ્યા. તેમણે લગ્ન કરાવનાર ગોર દયાશંકર ભગવાનજી સાથે તકરાર કરાવી બધા ગામના ભેગા કરી ઉપદેશ આપ્યો કે બાવા ઇમામશાહના ધર્મના અનુયાયીઓના લગ્ન બ્રાહ્મણ કરી શકશે નહિ પણ દરેક ગામનો મૂખી હોય તે દુવા પડી લગ્ન કરાવી લે અને મરણ પછી અગ્નિસંસ્કાર ન કરવો પણ દફન કરવું. તે દિવસથી લગ્નની તથા મરણ પછીના સંસ્કાર હતા તે પણ બંધ થયા અને ગોર બ્રાહ્મણ તથા ભાટને તમારી જ્ઞાતિમાંથી રજા આપી પુરણ મુમનની પદવી આપી અને પોતે સૈયદો તથા કાકાપુજ્ય બન્યા.

પછી તો વડીલોના ભોળા સ્વભાવને લઇને ગામેગામ ખાનાની જગ્યા બંધાવી તેમાં બેસી ઉપદેશના રૂપે ખોટી લાલચો બતાવી હિન્દુ ધર્મના કટ્ટા શત્રુ કબરપરસ્તી સૈયદો ગુરૂ બન્યા અને ધર્મ ધૂતારા કાકાઓને એજન્ટ બનાવ્યા. હુરાઓના આશક તથા સ્વર્ગના શોખીન એવા મૂખીઓ અને ભગતડાઓને તેઓએ મોટા ભા બનાવીને સૈયદોની વંશાવળીના કલ્પીત

realpatidar.com

https://archive.org/details/bk1205/page/n3/mode/1up

realpatidar.com

કલ્માઓ અને બનાવટી દુવાઓ બોલાવી અને મસાણી માટીની ગંદી ગોળીનું પાણી કરી એકજ વાટકીમાં એઠું જુઠું પાવળ પાવા માંડયું. રોજા રખાવ્યા, શુક્રવારી બીજો પળાવી, હિન્દુ ધર્મ વિરૂદ્ધ લગ્નમાં દુવા પઢીને પતાવવા લાગ્યા. તેમજ મરણુ વખતે પણ એજ દુવાઓ અને દરૂદ પઢીને ધરતીમાં દફનાવવાનું શરૂ કરાવ્યું.

મધરાતની પૂજાઓ કરાવી ગતગંગા વહેવડાવી ઘટપાટ–ગાયત્રી અને કલમા નિમાજ હેજંદાના નવરચિત કચુંબરનો ખીચડો બનાવી, નુરનામા, બાજનામા, અને તૈયબના કલમા પઢાવી, કબરો ઉપર રાંધેલો પ્રસાદ ચડાવી, મસાણમાંજ ખાવાની હદ સુધી કેટલાક ભાઇઓને પહોચાડયા.

વળી લુંટવામાં પણ હદ બહારના દશોંદ, વિશોંદ, ખુમસ, ખેરિઆત, વિગેરેના બહાને લાગા–લગવા, કર, જકાતનાં બનાવટી લાકડાં ગુસાડયાં.

મહોર નણુવંત, દુલદુલ ઘોડો, નુરીબરાખ, અને રોજાના ચિત્રવિચિત્ર નવરંગી ચિત્રો ચીતરીને ખૂબ નમાવ્યા.

આમ દિવસોદિવસ તેઓના નાટકો વધતાં જાય છે, તો પણ કોઈની આંખ ખુલી નહી, ત્યારે પરમકૃપાળુ પરમાત્માએ પોતાના પતિત થએલા આર્યપુત્રો પર પરમ સ્નેહભરી દયાદ્રષ્ટી કરી. હિન્દુ ધર્મનો નાશ થતો અટકાવવા પવિત્ર જ્ઞાતિમાતાના ઉદરે ધર્મવીર, નરકેશરી વીરપુત્ર ઉત્પન્ન કર્યો, જેના સિંહનાદે જ્ઞાતિબંધુઓની કુંભકરણ જેવી અઘોર નિન્દ્રા ઉડાડી જાગૃત કર્યા.

તેનાજ પ્રતાપે આજ આપણી જ્ઞાતિમાં જાગૃતિ આવી તેથી ગામેગામના મારા જેવા કેટલાએ ભાઇઓએ પોતાની ભૂલ સુધારી "પીરાણા સતપંથ"નો ત્યાગ કરી દેહશુધ્ધિ પ્રાયશ્ચિત કરાવી પાવન થઈ, શ્રી વિષ્ણુનારાયણના મંદિરો બંધાવી તેમાં શ્રી વિષ્ણુનારાયણની મૂર્તિઓ પધરાવી પોતાના પાપની માફી માગી રહ્યા છે. તે તમો તમારી સગી આંખોથી જુઓ છો.

છેવટમાં મારી નમ્ર અરજ.

વ્હાલા ભાઇ, મારી તમો પ્રત્યે માત્ર એટલીજ અરજ છે કે તમો હઠ, ધર્માન્ધતા તથા જુદાઈ વીગેરેને તજી મારી અરજના હેતુને સમજો, મેં જે કાંઈ આ લખ્યું છે તે તમારાંજ શાસ્ત્રો અને વર્તણુંક ઉપરથીજ લખ્યું છે. આ લખવાનો મારો હેતુ માત્ર એ છે કે તમો અસલ તથા નકલમાં, સાચા તથા જુઠામાં અને ભલા તથા બુરામાં વિચાર કરી શકો, અને તમારા તે ધર્મની મૂળ હકિકત અને તેના ઉત્પન્ન કરનારાઓના ગુપ્ત મુદ્દાઓ સ્પષ્ટ રીતે જાહેર થઇ જાય. કે જેથી તમો બારીક તપાસ તથા વિચારથી જોઇ શકો કે તમે જે કરો છો તે કયાં સુધી પરમાત્મા કે તેના વચનરૂપી વેદ પ્રમાણે ચાલનાર છે? કેમ કે તેમ ન થતાં પાછો કે આ તરફના ન રહ્યા તેમ પેલી તરફના પણ ન રહ્યા. તેટલા માટે મુખ્ય હકીકત ખુલ્લી કરી તમારી પાસે રજુ કરી છે.

હવે તમારી ફરજ છે કે તમે સારી [illegible] વિચાર કરો. પ્રથમ તથા છેવટને જુઓ. ખરા પવિત્ર વૈદિક સનાતન ધર્મના અને બીજા ધર્મના પુસ્તકોનો દીર્ઘદ્રષ્ટીથી અભ્યાસ કરીને મુકાબલો કરી જુઓ કે જેને તમે સતધર્મ માની તથા સમજી બેઠા છો તે શું ખરેખર સત્ય છે?

આ બધું જાણી સમજી મેં ખૂબ વિચાર કર્યો તો મને સાફ દેખાયું કે "પીરાણા:સતપંથધર્મ" અને તેના નિયમો અમારા જેવી પવિત્ર પાટીદાર જ્ઞાતિને કોઇ રીતે શોભી શકે તેવા નથી એમ ચોકખુ જણાઇ આવ્યું. તેથીજ "મેં પીરાણા સતપંથ ધર્મનો ત્યાગ કર્યો છે" તેમજ તમોને કહું છું કે જો તમે સર્વ રીતે પાટીદાર જેવી ઉચ્ચ જ્ઞાતિમાં ગણના કરાવવા માગતા હો તો આજેજ કાકા અને સૈયદોને છેવટની સલામ કરી તેમની ગુલામીની ધુંસરી એકદમ ફેંકી દઇ, સનાતન વેદધર્મ અંગીકાર કરી લેશો. અધીક શું લખુ જેને આંખ હશે તે વાંચશે, કાન હશે તે સાંભળશે, બુદ્ધિ હશે તે વિચારશે અને સમજ હશે તે "પીરાણા સતપંથ"નો ત્યાગ કરશે.

લી. પાટીદાર જ્ઞાતિનો અદના સેવક

ર ત ન શી શી વ જી પ ટે લ.

રવાપર, તાલુકો નખત્રાણા (કચ્છ.)

ઓરીયન્ટલ પ્રીં. પ્રેસ, ભુજ–કચ્છ

realpatidar.com